

રાજકોટ મહાનગરપાલિકા

ડો. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૧

-: અખબારી યાદી:-

રાજકોટ મહાનગરપાલિકાની જાહેર પરિવહન સેવાને કેન્દ્ર સરકારશ્રી દ્વારા
'Innovations undertaken in Urban Transport during COVID-19' અંતર્ગત
“Award Of Commendable Initiative” એવોર્ડ: મેયરશ્રી, ડે. મેયરશ્રી,
સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનશ્રી અને મ્યુનિ. કમિશનરશ્રીની જાહેરાત

તારીખ: ૧૦-૧૧-૨૦૨૦



કેન્દ્ર સરકારશ્રીના MINISTRY OF HOUSING AND URBAN AFFAIRS (MoUHA) ડીપાર્ટમેન્ટ દ્વારા The 13th Urban Mobility India Conference, 2020 (UMI-2020) અંતર્ગત કોવિડ-૧૯ મહામારી દરમિયાન શરૂ કરવામાં આવેલ સિટી ટ્રાન્સપોર્ટેશનમાં તકેદારીના ભાગરૂપે લેવામાં આવેલ તમામ જરૂરી initiatives અંગે પ્રેઝન્ટેશન તૈયાર કરી UMI-2020 માં ભાગ લેવા માટે પ્રપોઝલ રજૂ કરવા જાણ કરવામાં આવેલ. જે અન્વયે રાજકોટ શહેરમાં જાહેર પરિવહનનું સંચાલન કરતી રાજકોટ મહાનગરપાલિકાની સંપુર્ણ

હસ્તાંતરીત કંપની "રાજકોટ રાજપથ લી. (RRL)" દ્વારા બી.આર.ટી.એસ. તથા સિટી બસ સેવામાં કોવિડ-૧૯ દરમિયાન રાગયાળાને ફેલાતો અટકાવવા તેમજ તકેદારીના ભાગરૂપે આ બંને પરિવહન સેવાઓમાં કરવામાં આવેલ અગત્યની તમામ કામગીરીઓની વિગતો તૈયાર કરી UMI-2020 માં પ્રપોઝલ રજૂ કરવામાં આવેલ તેમ મેયરશ્રી બિનાબેન આચાર્ય , ડે. મેયરશ્રી અશ્વિનભાઈ મોલીયા , સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનશ્રી ઉદયભાઈ કાનગડ અને મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે જાહેર કરેલ છે.

સરકારશ્રીના MINISTRY OF HOUSING AND URBAN AFFAIRS ડીપાર્ટમેન્ટ દ્વારા નિયત કરવામાં આવેલ Penal Of Experts દ્વારા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રપોઝલની પસંદગી કરી 'Innovations undertaken in Urban Transport during COVID-19' કેટેગરી હેઠળ રાજકોટ મહાનગરપાલિકાને તારીખ ૯/૧૧/૨૦૨૦ ના રોજ સેકેટરીશ્રી , MoHUA શ્રી દુર્ગાશંકર મિશ્રા હસ્તક "Award Of Commendable Initiative" એવોર્ડ એનાયત કરવામાં આવેલ.

રાજકોટ મહાનગરપાલિકાનું જાહેર પરિવહનની સંચાલન કરતી કંપની રાજકોટ રાજપથ લી. (RRL) દ્વારા બી.આર.ટી.એસ. તથા સિટી બસ સેવામાં કોવિડ-૧૯ દરમિયાન લેવામાં આવેલ તકેદારીની વિગતો નીચે મુજબ છે.

- મિશન સ્માર્ટ સિટી પ્રોજેક્ટના ભાગ રૂપે RRL દ્વારા લોકડાઉન સમયગાળા દરમિયાન "ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ " (ITMS) સોફ્ટવેર બનાવવાની કાર્યવાહી કરવામાં આવેલ અને હાલની "મેન્યુઅલ સિટી બસ ઓપરેશન સિસ્ટમ" માંથી પરિવહન સેવાઓમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી આધારિત " ITMS SYSTEM" ને કાર્યરત કરવામાં આવેલ. જે અંતર્ગત ઇન્ફોર્મેશન ટેકનોલોજી આધારિત " Vehicle Planning Scheduling and Dispatch" (VPSD) સિસ્ટમની અમલવારી કરવામાં આવેલ છે. VPSD સિસ્ટમમાં પરિવહન સેવાઓ માટેના હયાત ઉપલબ્ધ Infrastructure and Manpower ને ધ્યાને લઈને નિયત કરવામાં આવેલ રૂટ પર જાહેર પરિવહન સેવાઓ પુરી પાડવામાં આવે છે.
- ITMS પોજેક્ટ અંતર્ગત ટિકિટિંગની કામગીરી માટે Automated Fare Collection System (AFCS) તથા Electronic Ticketing Machine (ETM) ને આગામી સમયમાં પરિવહન સેવાઓમાં ઉપયોગમાં લાવવા અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. હાલમાં સિટી બસ ટિકિટિંગની કામગીરી semi-automatic સ્વરૂપે કરવામાં આવે છે જે કામગીરીમાં રોકડ રકમની વસુલાત કરી મુસાફરની ટિકિટ આપવામાં આવે છે , ETM machine થકી આગામી સમયમાં મ લ્ટીપલ ઇનપુટ્સ એટલે કે ડિજિટલ સ્માર્ટ કાર્ડ / યુપીઆઈ ટ્રાન્ઝેક્શન / એપ આધારિત કોન્ટેક્ટલેસ ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન થકી મુસાફરને ટિકિટ આપવામાં આવશે
- કોવિડ-19 રોગચાળાના ફેલાવાને રોકવા માટે રાજકોટ રાજપથ લી. દ્વારા ભારત સરકારશ્રીની સલામત શહેરી પરિવહન સેવા માટે જારી કરવામાં આવેલા એસ.ઓ.પી. માર્ગદર્શિકા મુજબની

અમલવારી લાગુ કરવામાં આવેલ છે. રોજબરોજના જાહેર પરિવહન સેવાઓ માટે ઓપરેશન શરૂ થતાં પહેલાં બધી બસોને Disinfection Material દ્વારા જંતુનાશક કરી સફાઈ કરવામાં આવે છે. મુસાફરોને બસમાં મુસાફરી કરતા પહેલા સેનિટાઇઝરથી હાથ સાફ કરવા માટે તમામ બસોમાં સેનિટાઇઝર બોટલ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે . અત્રેની પરિવહન સેવાના ચેકિંગ સ્ટાફ (નિરીક્ષકો) દ્વારા મુસાફરોને માસ્ક પહેરવા, નિયમિતપણે હાથ સાફ કરવા અંગેનું માર્ગદર્શન આપવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુસાફરોમાં COVID-19 ની જાગૃતિ લાવવા અને વાયરસના ફેલાવાને રોકવા માટે તમામ બસોમાં આઇ.સી.સી. સ્ટીકરો ચોટાડવામાં આવે લ છે, ઠા.ત. મુસાફરોને તેઓના હાથની સ્વચ્છતા અને સામાજિક અંતર જાળવવા માટે જાગૃતિ લાવવા માટેના સ્ટીકરો , સામાજિક અંતર સાથે બેસવાની રીત અંગેના બસ લેઆઉટ દર્શાવતા સ્ટીકરો પ્રદર્શિત કરવામાં આવેલ છે.

- સિટી ટ્રાન્સપોર્ટેશન માટેની અનલોક-5 ની છેલ્લી ગાઇડલાઇન મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલમાં કુલ બસ ક્ષમતાના 75% જેટલી બસોની સંખ્યા દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે.

(જન સંપર્ક અધિકારી)